

Date: 14/08/2023

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531257 (PRATIKSHA CHEMICALS LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 30th June, 2023 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said unaudited financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **12th August, 2023.**


You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

FOR, PRATIKSHA CHEMICALS LIMITED

**MR. JAYESH PATEL
DIRECTOR
(DIN: 00401109)**



PRATIKSHA CHEMICALS LIMITED

Regd. Off : 3rd Floor, H. K. Complex , Nr. Dharnidhar Derasar, Paldi, Ahmedabad-380 007 India
Ph. 26632390, 26609530 Fax No : +91 79 26612843.

Website : <http://www.dharapratiksha.com> E-mail : exports@dharapratiksha.com

CIN : L24110GJ1991PLC015507

Factory : 195/2, Near Natraj Industrial Estate, Village Iyawa Vasna, Sanand.
(Dist : Ahmedabad) India. Phone 02717-284350

Arunachal transfers 11 Gw stalled hydropower projects to Central PSUs

Stalled hydropower projects in the state of Arunachal Pradesh, which have seen no progress in the past two decades, could finally see the light of day as the state government has transferred them to central public sector utilities.

Gujarat. All the developed nations, including the US, Canada, Norway, etc., have harnessed 80-90 per cent of their hydropower potential. In India, too, the states that harnessed the potential of hydropower have become prosperous. Hydropower is a green source of energy. Its usage will also increase the groundwater level and promote the growth of flora and fauna."

projects slated to be built by NHPHC were also diverted by the state government to private companies.

The Comptroller and Auditor General of India, which investigated these MoUs, criticised the move by the state government. Several companies that signed MoUs with the state never came back to construct the project after raising money in the name of the said MoU.

In each of these MoUs, the state government had a 26 per cent stake but lacked the financial wherewithal to contribute. The lack of state finances, protracted clearance processes, local protests, and environmental concerns stalled the plans of genuine players as well.

In its recent statement, the Union Ministry of Power said, "The development of these projects will contribute towards achieving the declared nationally determined contribution target of 500 Gw of non-fossil energy capacity in India by 2030."

"Hydropower will also be an effective contributor to the objective of achieving net-zero carbon emissions by the year 2070," it added.

These 12 hydroelectric projects, totalling 11 gigawatt (Gw), were awarded to several private companies at least 15 years ago, but none saw any progress.

In a public statement on Saturday, the Union Ministry of Power said the Government of India and the Government of Arunachal Pradesh have come together "to rejuvenate and execute 12 stalled hydroelectric power projects in the state".

The state government signed memoranda of agreement (MoUs) with three central public sector undertakings: NHPHC, SJVN, and NEEPCO, which is now a subsidiary of India's largest power generator, NTPC.

In the statement, Union Minister for Power, New and Renewable Energy R K Singh said, "The per capita income of the state would become more than that of Maharashtra and

Of these 12 projects, five of the 2.6 Gw capacity have been allocated to NEEPCO; another five of the 5 Gw capacity would go to SJVN, and the remaining two of the 3.8 Gw capacity would go to NHPHC.

NHPHC already has two mega hydropower projects in the state: the 2 Gw Subansiri Lower and the 2.88 Gw Dibang.

In 2003, the then National Democratic Alliance government announced plans to set up close to 50 Gw of hydropower capacity in the country, of which Arunachal was to build 25-30 Gw.

The state government, however, went on an MoU-signing spree with private companies to build hydroelectric projects. By 2009, the state had 153 MoUs, totalling 43 Gw. Some of the

FPIs invest in equities on global uncertainty, concerns over China

After short breather; FPIs invest in equities on global uncertainty, concerns over China New Delhi, Aug 13 (PTI) Foreign Portfolio Investors (FPIs) have infused over Rs 3,272 crore in Indian equities so far this month driven by uncertainty in the global markets, economic concerns in China, and stability of the domestic economy.

"Since the markets have rallied smartly during the last three months, some profit booking by FPIs would be rational and can be expected," VK Vijayakumar, Chief Investment Strategist at Geojit Financial Services, said.

With the global economic mood getting challenging due to slackening Chinese demand, any weakness in global equities could trigger wild gyrations in local shares and result in FPI flow turning choppy going ahead, Srikant Chouhan, Head of Equity Research (Retail) at

Kotak Securities, said.

According to the data with the depositories, Foreign Portfolio Investors (FPIs) have put in a net sum of Rs 3,272 crore in Indian equities from August 1-11.

However, in the first week of August, FPIs took a breather and pulled out over Rs 2,000 crore from equities.

"The uncertainty in the global markets and economic concerns in China again played a role in FPIs shifting their focus back toward Indian markets, which have been more resilient and stable," Himanshu Srivastava, Associate Director - Manager Research, Morningstar India, said. Also, better-than-expected earnings season for the June quarter lent positive support to the sentiments, he added.

"Despite stocks trading at higher levels, the June quarter

results have led to a reduction in the market's Price-to-Earnings (PE) ratio. This favorable PE ratio, backed by strong corporate performance, provides valuation comfort to FPIs," Mayank Mehra, small case manager and principal partner at Craving Alpha, said.

Additionally, the relative stability in the Indian Treasury rates, in contrast to the volatility observed in the US 10-year rates, enhances India's appeal for FPIs, he added.

Before August, Indian equities witnessed an unabated net inflow in the past five months from March to July on the resilience of the Indian economy amid an uncertain global macro backdrop. Moreover, FPIs invested over Rs 40,000 crore each in the last three months (May, June, and July). The net inflow was Rs 46,618 crore in July, Rs 47,148 crore in June, and Rs 43,838 crore in May.

Centre pushes for faster admission of corporate insolvency cases at NCLT

Benches of the National Company Law Tribunal (NCLT) should not get into questioning a company's default once it is established by the creditors, particularly financial creditors, for admission to the corporate insolvency process. This is one of the key themes of the draft guidelines for the NCLT, which are being finalised by the Ministry of Corporate Affairs (MCA), a senior official said.

According to the official, while the company law matters could involve the "principle of natural justice" and justify extended

proceedings to hear all parties concerned, the same does not apply to the Insolvency and Bankruptcy Code (IBC) proceedings.

"If a default has been established by the creditor, there is no need for the adjudicating authority to further look into the matter and admit challenging petitions, which only delay the process," the official said.

The need to differentiate between the two arises because the NCLT, which came into existence even before the IBC, operates using rules that were set up for company law matters. To reduce delays at the adjudicating authority level, the MCA has drafted

IBC-specific guidelines, starting with the first stage of application admission.

For instance, a decision on admitting an application is supposed to take 14 days according to the IBC.

In practice, however, case admissions in the NCLT have been one of the biggest bottlenecks in the insolvency proceedings, which take up to a year or more, with the tribunal often questioning and admitting litigations against initiation of this process.

"As long as the default of the corporate debtor is proved by the creditor, it is imperative that the corporate debtors get admitted into insolvency," said Anshul Jain, partner at PwC India.

Demand for single window clearance

The MCA could also look into the industry's demand for a single window clearance for companies resolved under the IBC, for different processes falling under the Company Law. These processes include changes in the company's board of directors, promoters, share capital, as well as issues related to non-compliance, according to industry sources.

Experts point out that when a resolution applicant acquires a corporate debtor, it faces several difficulties in changing directors, cancelling current capital, and issuing new shares because there is no process under the Companies Act or e-forms that enable such changes.

"Despite the MCA being the nodal ministry for IBC, such procedural enablements are yet to be done in RoC processes. It is high time that a resolution plan, once approved by the NCLT, be considered a single window clearance for all processes and procedures under company law and Sebi regulations," Jain said.

Between November 2017 and August 2022, the NCLT dealt with 31,203 cases for initiating insolvency, of which 7,175 were pending in pre-admission stage and 3,369 post-admission, according to the data provided by the tribunal.

The MCA also plans to empower NCLT to take action against those filing frivolous litigation adding to delays. To address these delays, the MCA has proposed mandatory admission of applications filed by financial creditors, once it is satisfied of the occurrence of default.

The MCA is also proposing that the information regarding the occurrence of a default or dispute be ascertained at the information utility (IU), which can be relied upon for speedy default verification.

The MCA's consultation paper has proposed a provision that when the IBC is initiated by financial or operational creditors, the adjudicating authority should rely solely on records available with the IUs.

Deloitte, Adani Ports & SEZ spar over Hindenburg Research's claims

Before resigning as auditor of Adani Ports & SEZ, Deloitte had sought an independent external examination of allegations made by American short-seller Hindenburg Research but the company claimed the accusations had no impact on financial statements. The Adani group firm also said its audit committee believed that "the grounds advanced by Deloitte for resignation as statutory auditor were not convincing or sufficient to warrant such a move".

In a 163-page filing with the BSE about its resignation, Deloitte said it had in May this year raised concern about certain transactions flagged in the report of the short-seller. These included recoveries from a contractor identified in that report.

"We requested the company to initiate an independent external examination of these allegations to determine whether these allegations may have any possible effect on the standalone financial statements of the company," Deloitte said, adding that "the company represented to us that these allegations have no effect on the standalone financial statements of the company".

The Adani group did not consider it necessary to have an independent external examination of these allegations because of the ongoing investigation by the

Hindenburg report.

"As on March 31, 2023, a net balance of Rs 2,457.05 crore is recoverable from this contractor, of which Rs 713.63 crore relate to security deposits paid to the contractor and Rs 1,501.50 crore in respect of capital advances," it said.

Also, the group "re-negotiated the terms of sale of its container terminal under construction in Myanmar" to Anguilla-incorporated Solar Energy. The sale consideration was revised from Rs 2,015 crore to Rs 246.51 crore and an impairment charge was taken. The group told the auditor these are not related parties.

On the other hand, Adani Ports stressed: "We are fully confident that these matters will be appropriately resolved in our September '23 filing."

Earlier, the board of Adani Ports and SEZ appointed MSKA & Associates, an independent member firm of BDO International, as auditor after Deloitte resigned.

Adani Ports, India's largest private port operator, in a statement said since May 2017, Deloitte was APSEZ's statutory auditor and was reappointed as its statutory auditor for another term of five years in 2022.

"In Deloitte's recent meeting with the APSEZ management and its audit committee, which, by policy, is comprised of and chaired by independent directors,

Foxconn Technology looks at India as its third global electric vehicle hub

Foxconn Technology Group is looking at India as its third global base for tapping into the potential electric vehicle (EV) outsourcing market, with plans to capture 5 per cent of the sales worldwide by 2025. The company aims to deliver between 500,000 and 700,000 EVs by that time.

The Taiwanese company has already acquired a plant in Ohio, US, for \$230 million, capable of producing 500,000-600,000 vehicles annually.

Another EV plant is situated in Thailand, established through a joint venture (JV) with state energy company PTT. The Thai plant has a capacity of 50,000 units a year, with the potential to increase it to 150,000 units per year. The EV assembly unit will begin with electric two-wheelers that are geared for the domestic and Southeast Asian markets.

While Foxconn assembles only commercial EVs and e-buses, it has plans to manufacture passenger cars this year, the company said in its annual report released recently. A Foxconn

representative in India didn't divulge the details.

Discussions with Telangana and Tamil Nadu for setting up an EV plant have taken place, and a decision is expected soon.

Foxconn has partnered Yulon Motor Co., a major automaker in Taiwan, to produce the first EV based on the Foxconn car platform, the Model C, under the brand name Luxgen7.

With only 30 per cent of its revenues from non-China locations, Foxconn is also considering Mexico, Vietnam, Indonesia, and Europe for potential plant locations.

Industry analysts believe that Foxconn is poised to capitalise on the intense competition in the EV sector (Tesla was forced to cut the price of its cars).

Established original equipment manufacturers could outsource their production to reduce costs. Additionally, new entrants lacking bargaining power over the supply chain or manufacturing experience might also choose to outsource

In India, Foxconn could leverage its status as the largest electronic manufacturing services provider, being Apple's largest vendor for iPhones in both domestic and export markets.

Bharat FIH, Foxconn's Indian entity, has been producing electronic components for EV two-wheeler companies like Ather Energy and Ola Electric since 2015.

In fact, India has a vibrant supply chain of auto components required for EVs. The company is also planning to establish a compound semiconductor fab plant for gallium nitride and silicon carbide chips, essential components for the electric auto industry.

Foxconn's EV strategy includes partnerships for various EVs, including an electric truck with Fisker, an electric car with Yulon Motors, and a three-seater affordable EV in collaboration with Santi Group and JV partner PTT, priced between \$10,000 and \$20,000.

from Rs 1,098 crore, according to an analysis based on the performance of five listed SFBs -- AU, Equitas, Suryoday, Utkarsh, and Ujjivan.

The banks' NII expanded 23.8 per cent Y-o-Y to Rs 3,381 crore, reflecting the advantage of increased lending rates. However, quarter-on-quarter (Q-o-Q), NII growth moderated to 3.1 per cent from Rs 3,278

crore, partly illustrating the effect of deposit repricing. High growth in credit offtake during Q1FY24, generally seen as a period of moderate activity, aided NII. Additionally, a pattern of immediate repricing of loans, while deposit revision lagged, contributed to the strong showing in the first quarter of FY24, according to bankers.



Securities and Exchange Board of India (SEBI).

"The assessment by the company did not constitute sufficient appropriate audit evidence for the purposes of our audit," Deloitte said in the filing.

When contacted, Deloitte declined to comment. The Adani group firm said Deloitte quit after not getting the auditing mandate of other group companies, even as "the 'other matters' highlighted in the auditor's resignation are adequately disclosed and addressed in our FY23 financial statements".

In the absence of an independent external examination and the pending completion of investigation by Sebi, the auditor in the exchange filing said it could not comment if the company was fully compliant with the law and if the transactions flagged might result in possible adjustments and/or disclosures in the financial statement in respect of related parties.

The transactions flagged by Deloitte included engineering, procurement and construction (PEC) purchase contracts with a subsidiary of a party identified in the

including G K Pillai, G Raghuram, P S Jayakumar and Nirupama Rao, Deloitte indicated a lack of a wider audit role as auditors of other listed Adani portfolio companies," it said.

"It was also conveyed that it is not within the remit of APSEZ and its board to recommend group-wide appointments as other listed Adani portfolio companies are completely independent, with separate boards, executive teams and minority shareholders," the statement said. "Deloitte was not willing to continue as APSEZ's statutory auditor and, therefore, it was agreed to amicably end the client-auditor contractual relationship between APSEZ and Deloitte," it said. A source referred to the "other matters" in the annual report, which said Deloitte is not the auditor of a majority of Adani group companies and hence its scope of audit does not include other transactions or balances between Adani group companies or suppliers which may have had a business relationship with APSEZ.

The abrupt departure of the auditor comes just a few days before the Supreme Court deadline of August 14 to Sebi to complete its investigation.

REC, Supreme stocks surge on MSCI Global Standard Indexes inclusion

The net profit of listed small finance banks (SFBs) surged 59 per cent year-on-year (Y-o-Y) to Rs 1,057 crore in the first quarter ended June 2023 (Q1FY24), driven by healthy growth in net interest income (NII) and other income streams, such as treasury gains and fees.

Sequentially, however, net profit declined 3.73 per cent

from Rs 1,098 crore, according to an analysis based on the performance of five listed SFBs -- AU, Equitas, Suryoday, Utkarsh, and Ujjivan.

The banks' NII expanded 23.8 per cent Y-o-Y to Rs 3,381 crore, reflecting the advantage of increased lending rates. However, quarter-on-quarter (Q-o-Q), NII growth moderated to 3.1 per cent from Rs 3,278

crore, partly illustrating the effect of deposit repricing.

High growth in credit offtake during Q1FY24, generally seen as a period of moderate activity, aided NII.

Additionally, a pattern of immediate repricing of loans, while deposit revision lagged, contributed to the strong showing in the first quarter of FY24, according to bankers.

PRATIKSHA CHEMICALS LIMITED
 REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007
 CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in
 PH : 079-26632390 E-MAIL: exports@dhapratiksha.com

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2023 (Rs. In Lacs)

Sr. No	PARTICULARS	Quarter ended on 30th June, 2023	For the year ended on 31st March, 2023	Corresponding 3 Months Ended on 30th June 2022
1	Total income from operations	195.98	996.70	289.98
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3.41	12.09	2.69
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	3.41	12.09	2.69
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	2.72	8.79	-0.83
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2.72	8.79	-0.83
6	Equity Share Capital	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	-	(199.28)	-
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)			
	Basic :	0.05	0.16	-0.01
	Diluted :	0.05	0.16	-0.01

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
 2. The result of the Quarter ended on 30th June, 2023 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 12th August, 2023.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED
 SD/-
 Place : Ahmedabad Mr. Jayesh Patel
 Date : 12th August, 2023 Director
 (DIN : 00401109)

ધી જ્યુઝલાઇબ

વર્ષ : ૨૯ અંક : ૨૯૪ તા.૧૪-૮-૨૦૨૩ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

કરેકશન થોડુંક લાંબુ ચાલ્યું

લાર્સન એન્ડ ટુબો સતત લેવડાવીએ છીએ, આ શેરમાં ડ્રા. ૨૬૯૬નો ભાવ આવી જવાની સંભાવના



નિફ્ટી ૨૦૦૦ની નજીક ગયા પછી થોડીક થાક પાશો તેમ દર્શાવ્યું હતું તેમ છતાં કરેકશનનો આ તબક્કો થોડાક લાંબો ચાલી રહ્યો છે. બીજા અઠવારિયે પણ કરેકશન જોવાયું અને હજી નવા અઠવારિયામાં પણ સેન્સેક્ષ અને નિફ્ટીમાં નબળાઈ જોવા મળે તે સંભાવના મજબૂત છે. નિફ્ટીના માંડ મૂંઢે અને શોર્ટટર્મ ખેલાડીઓને પ્રિય તેવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક વગેરે તમામ શેરોમાં હજી પણ નબળાઈનો તબક્કો ચાલુ રહે તે સંભાવના મજબૂત છે.

ચુરુવારે રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં કોઈ જ ફેરફાર ન કરાયો પરંતુ તેમણે કુગાવાના અંદાજમાં થોડાક વધારો કર્યો છે અને સાથે સાથે રિઝર્વ રેશિયોમાં ફેરફાર કરીને બજારમાંથી જંગી લિક્વિડિટી પાછી ખેંચવાની પણ મ્યુચ્યુઅલ અપનાવવામાં આવી છે. સામે પક્ષે અમેરિકન અર્થતંત્ર પૂલ જ મજબૂતી દર્શાવે છે અને ફ્રિચ દ્વારા અમેરિકાનું સોવેરિયન રેટિંગ ડાઉનગ્રેડ કરાયાની અસર એક કે બે સેશન જોવાયા પછી તેની અસર અદ્યથ થઈ ગઈ છે.

સામે પક્ષે અમેરિકામાં કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા ઘણા જ સારા આવતા જાય છે. અને સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારની લેવલ તેમજ કમ્પ્યુટર કોન્સિડરમાં પણ સુધારાનો ટ્રેન્ડ જોવાયો છે.

બીજી તરફ યુરોપિયન અર્થતંત્રમાં પણ અગાઉ જે ઘટાડાનો ભય હતો તે હવે ઘટતો જાય છે અને સામે પક્ષે રૂબે રૂબ પૂરા પોતાના અર્થતંત્રના ઝડપી વૃદ્ધિદર માટે કેટલાક મહત્વના પગલાઓ લેવાયા છે. અને આ તમામ પરિબલોની અસર હજી એક અઠવારિયા પછીના દિવસોમાં જોવા મળે તેવી ગણતરી છે.

આ તબક્કો શોર્ટટર્મ ખેલાડીઓનું કોક્ષ મીડકેપ અને સ્મોલકેપ શેરો ઉપર જ શિક્ષક થઈ ગયું છે અને બીજી તરફ ભલે નિફ્ટીમાં ઝડપી ઉછાળો અત્યારે અટક્યો હોય પરંતુ કંપનીઓના પ્રમોટરો અત્યારે બજારના ભૂલી શકાય તેવા અર્થોર્થો લાભ લઈને ઝડપથી આઈપીઓ લાવી દેવા માટે ઉત્સુક બની ગયા છે. અગાઉ અઠવારિયામાં એક કે બે એક્સએમઈ આઈપીઓ ખૂલતા હતા પરંતુ તેને બદલે હવે એક સાથે સાત સાત એક્સએમઈ આઈપીઓ અને બે કે ત્રણ મેઈન બોર્ડ આઈપીઓ ખૂલી રહ્યા હોય તેવો માહોલ છે અને જે આઈપીઓમાં ખાસ કોઈ જ આકર્ષણ ન હોય, ફન્ડમેન્ટલમાં પણ કસ ન હોય તેવા આઈપીઓ પણ અત્યારે ૧૦૦થી ૪૦૦ ગણા ભરાઈ જતા વાર નથી લાગતી. સાદા શબ્દોમાં કહીએ તો ઈન્વેસ્ટરો અત્યારે ઘેલા થયા છે અને એક તરફ કમાવા માટે તનતોડ મહેનત કરે પરંતુ થર્ડલાસ કંપનીઓમાં પૈસા રોકી દેતા એક મિનિટનો પણ વિચાર નથી કરતા અને પછી જ્યારે આ થર્ડલાસ કંપનીઓમાં પૈસા ફસાઈ જાય ત્યારે શેરબજારનો વાંક કાઢે છે. બરાબર આ જ રીતનો માહોલ સને ૧૯૯૩-

જશે તે સંભાવના છે. **પંખા નેશનલ બેંક** ડ્રા. ૬૧.૨૫ ઉપર આવ્યો છે અને તેમાં થોડા દિવસો ટૂંકી વધુ ઉપર રહ્યા પછી વધારે તોફાની ઉછાળો જોવાશે. નિરવ મોટીનું કોભાંડ થયું તે પહેલા આ શેર ડ્રા. ૪૦૦ ઉપર ચાલતો હતો તે પાસું ખાસ ધ્યાનમાં રાખવું પડે અને તેથી મલ્ટીબેગરની દૃષ્ટિએ તમે ડ્રા. ૬૧ના ભાવનો આ શેર ક્વર કરતા જશો. ડ્રા. ૧૮૦૦વાળા **કોટક બેંક**ના શેરમાં હજી કરેકશન અને ઘટાડાનો ટ્રેન્ડ ચાલે છે અને થોડા દિવસોમાં બીજા ડ્રા. ૨૦ ઘટવાની જગ્યા છે.

એચ સ્મોલ ફિનાન્સ બેંક અત્યારે ડ્રા. ૭૦૨ ઉપર છે અને આ શેરમાં આવતા થોડા દિવસો દરમ્યાન ભાવ વધારે ઝડપથી ટૂંકીને ડ્રા. ૬૮૦-૬૯૦ સુધી ઉતરી જવાની ગણતરી છે. અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય. ડ્રા. ૧૩૪ ઉપરના **ફેડરલ બેંક**માં આવતા થોડા દિવસો ધીમો સુધારો જોવા મળવાની ગણતરી. જ્યારે ડ્રા. ૧૮૨ વાળા **બેંક ઓફ ગ્રો**માં હજી થોડા દિવસો કોન્સોલિડેશન અને ઘટાડો જોવા મળવાની સંભાવના છે અને તેથી કરેકશન આ તબક્કા દરમ્યાન થોડું થોડું રોકાણ વધારી શકાય.

કંપનીઓના પરિણામો એકંદરે સંતોષકારક આવ્યા છે. બેંકોના આંકડાઓ અપેક્ષા કરતા વધારે સારા આવ્યા, જ્યારે એફએમસીએ અને સિમેન્ટ કંપનીઓમાં પણ ટર્નઅરોઉન્ડ ટ્રેન્ડ જોવાયો છે. સ્ટીલમાં અપેક્ષા મુજબ નબળો ટ્રેન્ડ જોવાયો, તેમ છતાં અનેક એનાલિસ્ટોનું મંતવ્ય છે કે જૂન ક્વાર્ટરમાં ભલે પ્રોત્સાહક ટ્રેન્ડ જોવાયો હોય પરંતુ હવે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેઝ ઈન્ફેક્ટને કારણે અનેક સેક્ટરોના આંકડા નબળા આવશે તે સંભાવના મજબૂત છે અને ખાસ કરીને બેંકિંગ સેક્ટરમાં બેઝ ઈન્ફેક્ટની મોટી અસર જોવા મળશે તેવો ભય છે.

પ્રેમવત્સ ગ્રૂપ હસ્તકની **સીએસબી બેંક**નો શેર અત્યારે ડ્રા. ૩૦૬ ઉપર છે અને આ શેરમાં ધીમો અપડ્રેન્ડ શરૂ થઈ ગયો છે. આવતા થોડા દિવસોમાં જ આ શેરમાં ડ્રા. ૩૧૩ અને તે પછી ડ્રા. ૩૨૦ના ભાવની સંભાવના છે.

સિટી યુનિયન બેંકનો શેર પણ અત્યારે કોન્સોલિડેશનના તબક્કામાં છે અને તેમાં પણ એકદમ મોટા ઉછાળાની જગ્યા નથી. જ્યારે **યુનિયન બેંક** ડ્રા. ૬૯થી ઊંચે ચાલ્યો છે. ૯૦ ઉપર આવ્યો છે અને લગભગ બે અઠવારિયા આ શેરમાં કોન્સોલિડેશનનો ટ્રેન્ડ જોવાયો પછી તેમાં વધારે ઝડપી ઉછાળા સાથે ડ્રા. ૯૨-૯૦નો ભાવ આવવાની ગણતરી છે અને તેથી આ શેર ઉપર આવીએ તો આ શેરમાં હજી ભાવ થોડોક ઘટે તે ભય મોટો છે. તેમ છતાં લગભગ બે અઠવારિયાના કરેકશન પછી સ્ટેટ બેંકનો શેર ઝડપથી ઊંચે ચાલ્યો શરૂ થઈ જશે અને તેથી તેમાં રોકાણ વધારના જવાય.

આઈસીએફસી ફર્સ્ટ બેંકના આવાજા ડ્રા. ૧૪૦૦નો ભાવ આવવાની ગણતરી છે અને તેથી આઈસીએફસીઆઈ બેંકમાં રોકાણ વધારી શકાય. ફન્ડમેન્ટલની સરખામણમાં આ શેર કેવળ ૧૭.૯૩ના પીઈરિશિયો ઉપર છે અને તેમાં રીટેઈંગ સાથે ૨-૨નો પીઈરિશિયો જોવા મળે તે સંભાવના છે.

સામે પક્ષે **એચસીએફસી** પણ અત્યારે શોર્ટટર્મ કોન્સોલિડેશન અને સુધારાનો તબક્કો ચાલી રહ્યો છે. ડ્રા. ૯૮૦ ટથ થયા પછી અત્યારે ડ્રા. ૯૩૦નો ભાવ ચાલે છે અને ૨૩.૦૨નો પીઈરિશિયો દર્શાવે છે. એક્સિસ બેંકમાં માર્ચ ક્વાર્ટરના આંકડા નબળા હતા અને તે પછી હવે જૂન ક્વાર્ટરના આંકડા નોર્મલ લેવલ ઉપર આવ્યા છે અને તેથી આ શેરમાં છેલ્લા ૧૨ મહિનાના શેરદીક કમાણી કે પીઈરિશિયોને આધારે નિર્ણય લેવા જતા મુદ્દા બની જવાય. નવા વર્ષમાં ડ્રા. ૫૦થી ૫૫ની શેરદીક કમાણી હાંસલ થવાની સંભાવના મજબૂત છે અને તેની સામે શેર અત્યારે ૨૦થી પણ નીચા પ્રક્રિયા ઝડપથી ઉપર ચાલે છે અને તેથી થોડુંક રોકાણ કરી દેવાય.

સ્ટેટ બેંકમાં હવે મૂળ જ મોટા રીટેઈંગની ગણતરી છે. નફામાં સુંદર ઉછાળો જોવાયા પછી ડ્રા. ૫૩૩વાળા આ શેરમાં હજી થોડા દિવસો બજારની સાથે સાથે ટ્રેન્ડ નબળો રહે તે ભય મોટો છે. તેમ છતાં લગભગ બે અઠવારિયાના કરેકશન પછી સ્ટેટ બેંકનો શેર ઝડપથી ઊંચે ચાલ્યો શરૂ થઈ જશે અને તેથી તેમાં રોકાણ વધારના જવાય.

આઈસીએફસી ફર્સ્ટ બેંક પ્રોત્સાહક પરિણામોના સપોર્ટથી ડ્રા. ૯૭.૮૫ ઉપર આવી ગયો છે અને આ શેરમાં હજી પણ લાંબી તેજની જગ્યા છે. આગામી દિવસોમાં ધીરે ધીરે ડ્રા. ૯૧ અને તે પછી ડ્રા. ૯૫નો ભાવ થોડા અઠવારિયામાં જોવા મળવાની ગણતરી છે અને તેથી અત્યારના ભાવે પણ થોડાક આઈસીએફસી ફર્સ્ટ બેંક લઈને મૂકી શકાય.

શોર્ટટર્મ ખેલાડીઓની લેવાલી **ઈન્ફોસીસ બેંક**ના શેરમાં પણ વધતી જાય છે. હિન્દુજા ગ્રૂપની આ બેંક ડ્રા. ૧૪૩૦ ઉપર છે અને તેમાં જૂન ક્વાર્ટરના આંકડા મૂળ જ જોરદાર આવ્યા છે અને વધારે જોરદાર આંકડા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આવશે તે સંભાવના છે. હજી લગભગ ત્રણેક અઠવારિયા એકદમ ધીમો સુધારો જોવાયો પછી આ શેરમાં ડ્રા. ૧૪૨૦ના લેવલથી તેજ ઝડપી બનશે તેમ દેખાય છે અને તેથી થોડાક થોડા કરીને શેર ભેગા કરી શકાય.

બંધન બેંક અત્યારે ડ્રા. ૨૨૮ ઉપર છે અને તેમાં પણ કામગીરી સુંદર છે. ડ્રા. ૨૧૦ના લેવલથી કરેકશન પૂર્ણ કરીને આ શેર ડ્રા. ૨૨૮ ઉપર આવ્યો છે અને તેમાં થોડા દિવસો હજી ડ્રા. ૨૩૫-૨૨૫ની રેન્જમાં ભાવ અચડાઈ જવાની ગણતરી છે. લગભગ બેથી ત્રણ અઠવારિયા આ રીતે કરેકશનનો ટ્રેન્ડ બતાવ્યા પછી ભાવ ઝડપથી ઊંચકાઈ

અને આ પાસાને કારણે ડ્રા. ૨૦૩વાળા જનરલ ઈન્સ્યોરન્સના શેરમાં આગામી દિવસોમાં ડ્રા. ૨૧૮ અને તે પછીના ઉછાળો ડ્રા. ૨૩૦નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.

કેટિટ કાર્ગીની એકમાત્ર કંપનીનું લિક્વિડ થયું છે અને તેમાં **એસબીઆઈ કાર્ડ** પૂલ જ મજબૂત કામગીરી દર્શાવે છે. અત્યારે ડ્રા. ૬૭૨વાળા આ શેરમાં આવતા થોડા દિવસો ટૂંકી વધુ ઉપર રહ્યા પછી વધારે તોફાની ઉછાળો જોવાશે. નિરવ મોટીનું કોભાંડ થયું તે પહેલા આ શેર ડ્રા. ૪૦૦ ઉપર ચાલતો હતો તે પાસું ખાસ ધ્યાનમાં રાખવું પડે અને તેથી મલ્ટીબેગરની દૃષ્ટિએ તમે ડ્રા. ૬૧ના ભાવનો આ શેર ક્વર કરતા જશો.

સામે પક્ષે **આઈસીએફસીઆઈ બેંક** પણ અત્યારે શોર્ટટર્મ કોન્સોલિડેશનના તબક્કામાં છે. ફેબ્રુઆરી, ૨૦૨૩માં ડ્રા. ૮૦૦નું બોટમ જોવાયા પછી આ શેર જુલાઈ આખરમાં ડ્રા. ૧૦૦૦ની ઉપર ગયો હતો અને અત્યારે ડ્રા. ૯૬૪ ઉપર છે. લગભગ અઠવારિયું કોન્સોલિડેશનનો ટ્રેન્ડ બતાવ્યા પછી આ શેરમાં નવી તોફાની તેજ સાથે ડ્રા. ૯૭૨ અને તે પછીના થોડા દિવસોમાં ડ્રા. ૯૮૦ અને તે પછી ડ્રા. ૯૯૫ના ભાવની ગણતરી છે અને તેથી આઈસીએફસીઆઈ બેંકમાં રોકાણ વધારી શકાય. ફન્ડમેન્ટલની સરખામણમાં આ શેર કેવળ ૧૭.૯૩ના પીઈરિશિયો ઉપર છે અને તેમાં રીટેઈંગ સાથે ૨-૨નો પીઈરિશિયો જોવા મળે તે સંભાવના છે.

સામે પક્ષે **એચસીએફસી** પણ અત્યારે શોર્ટટર્મ કોન્સોલિડેશન અને સુધારાનો તબક્કો ચાલી રહ્યો છે. ડ્રા. ૯૮૦ ટથ થયા પછી અત્યારે ડ્રા. ૯૩૦નો ભાવ ચાલે છે અને ૨૩.૦૨નો પીઈરિશિયો દર્શાવે છે. એક્સિસ બેંકમાં માર્ચ ક્વાર્ટરના આંકડા નબળા હતા અને તે પછી હવે જૂન ક્વાર્ટરના આંકડા નોર્મલ લેવલ ઉપર આવ્યા છે અને તેથી આ શેરમાં છેલ્લા ૧૨ મહિનાના શેરદીક કમાણી કે પીઈરિશિયોને આધારે નિર્ણય લેવા જતા મુદ્દા બની જવાય. નવા વર્ષમાં ડ્રા. ૫૦થી ૫૫ની શેરદીક કમાણી હાંસલ થવાની સંભાવના મજબૂત છે અને તેની સામે શેર અત્યારે ૨૦થી પણ નીચા પ્રક્રિયા ઝડપથી ઉપર ચાલે છે અને તેથી થોડુંક રોકાણ કરી દેવાય.

સ્ટેટ બેંકમાં હવે મૂળ જ મોટા રીટેઈંગની ગણતરી છે. નફામાં સુંદર ઉછાળો જોવાયા પછી ડ્રા. ૫૩૩વાળા આ શેરમાં હજી થોડા દિવસો બજારની સાથે સાથે ટ્રેન્ડ નબળો રહે તે ભય મોટો છે. તેમ છતાં લગભગ બે અઠવારિયાના કરેકશન પછી સ્ટેટ બેંકનો શેર ઝડપથી ઊંચે ચાલ્યો શરૂ થઈ જશે અને તેથી તેમાં રોકાણ વધારના જવાય.

આઈસીએફસી ફર્સ્ટ બેંક પ્રોત્સાહક પરિણામોના સપોર્ટથી ડ્રા. ૯૭.૮૫ ઉપર આવી ગયો છે અને આ શેરમાં હજી પણ લાંબી તેજની જગ્યા છે. આગામી દિવસોમાં ધીરે ધીરે ડ્રા. ૯૧ અને તે પછી ડ્રા. ૯૫નો ભાવ થોડા અઠવારિયામાં જોવા મળવાની ગણતરી છે અને તેથી અત્યારના ભાવે પણ થોડાક આઈસીએફસી ફર્સ્ટ બેંક લઈને મૂકી શકાય.

શોર્ટટર્મ ખેલાડીઓની લેવાલી **ઈન્ફોસીસ બેંક**ના શેરમાં પણ વધતી જાય છે. હિન્દુજા ગ્રૂપની આ બેંક ડ્રા. ૧૪૩૦ ઉપર છે અને તેમાં જૂન ક્વાર્ટરના આંકડા મૂળ જ જોરદાર આવ્યા છે અને વધારે જોરદાર આંકડા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આવશે તે સંભાવના છે. હજી લગભગ ત્રણેક અઠવારિયા એકદમ ધીમો સુધારો જોવાયો પછી આ શેરમાં ડ્રા. ૧૪૨૦ના લેવલથી તેજ ઝડપી બનશે તેમ દેખાય છે અને તેથી થોડાક થોડા કરીને શેર ભેગા કરી શકાય.

બંધન બેંક અત્યારે ડ્રા. ૨૨૮ ઉપર છે અને તેમાં પણ કામગીરી સુંદર છે. ડ્રા. ૨૧૦ના લેવલથી કરેકશન પૂર્ણ કરીને આ શેર ડ્રા. ૨૨૮ ઉપર આવ્યો છે અને તેમાં થોડા દિવસો હજી ડ્રા. ૨૩૫-૨૨૫ની રેન્જમાં ભાવ અચડાઈ જવાની ગણતરી છે. લગભગ બેથી ત્રણ અઠવારિયા આ રીતે કરેકશનનો ટ્રેન્ડ બતાવ્યા પછી ભાવ ઝડપથી ઊંચકાઈ

અને આ પાસાને કારણે ડ્રા. ૨૦૩વાળા જનરલ ઈન્સ્યોરન્સના શેરમાં આગામી દિવસોમાં ડ્રા. ૨૧૮ અને તે પછીના ઉછાળો ડ્રા. ૨૩૦નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.



કોક્ષ રખાય. ડ્રા. ૩૧ ઉપરના **સેન્ટ્રલ બેંક**ના શેરમાં પણ લગભગ ૧૦ દિવસ કોન્સોલિડેશન જોવાયા પછી નવી તેજનો પ્રારંભ થયો અને તેથી આ શેર ઉપર કોક્ષ રાખવું.

ઈન્ડિયન બેંકનો શેર ડ્રા. ૩૮૦ ઉપર છે અને તેમાં થોડુંક રોકાણ કર શકાય. આવતા થોડા દિવસોમાં જ ડ્રા. ૪૧૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. જ્યારે **ઈન્ડિયન ઓવરસીઝ બેંક** ડ્રા. ૨૬.૯૫ ઉપર છે અને આ શેરમાં પણ એકદમ ધીમો અપડ્રેન્ડ શરૂ થયો છે અને તેથી ઝડપથી મોટું રિટર્ન મળે તે ગણતરીએ થોડાક ઈન્ડિયન ઓવરસીઝ બેંક લઈને મૂકી દેજો.

ઈન્સ્યોરન્સ શેરોમાં મૂળ જ ઝડપથી ભાવ વધ્યા પછી છેલ્લું અઠવારિયું કોન્સોલિડેશનનું રહ્યું. **એચડીએફસી બેંક**નો શેર અત્યારે ડ્રા. ૬૪૦ ઉપર છે અને તેમાં હજી એકાદ અઠવારિયું કોન્સોલિડેશન જોવાયા પછી નવી મોટી તેજ સાથે ડ્રા. ૬૫૦ અને તે પછી ડ્રા. ૬૭૦ના ભાવની ગણતરી છે અને મધ્યમગાળે આ શેર ડ્રા. ૭૦૦નું લેવલ પણ ફૂંકાવી શકશે.

જ્યારે **એસબીઆઈ લાર્ડફ** અત્યારે ડ્રા. ૧૩૩૪ ઉપર છે અને આ શેરમાં પણ એકાદ અઠવારિયું કોન્સોલિડેશનનો ટ્રેન્ડ જોવાયા પછી નવી મોટી તેજ સાથે ડ્રા. ૧૪૦૦ અને તે પછી ધીરે ધીરે ડ્રા. ૧૪૫૪ના ભાવની સંભાવના છે. એસબીઆઈ લાર્ડફનો શેર પણ નાના લોટમાં ક્વર કરી શકાય.

આઈસીએફસીઆઈ ટ્રૂ લાર્ડફ અત્યારે ડ્રા. ૫૭૫ ઉપર છે અને તેમાં પણ ઈન્વેસ્ટમેન્ટની રીતે રોકાણ કરી શકાય. શોર્ટટર્મમાં મોટો ઉછાળો નથી દેખાતો. લગભગ એકબે અઠવારિયા આ શેરમાં ટૂંકી વધુ ઉપર પડી રહેવાની ગણતરી છે અને તે પછી ઉછાળો જોવાય.

રાકેશ ગુનગુનવાલાની **સ્ટાર ટેલે ઇન્વેસ્ટમેન્ટ**નો શેર અત્યારે ડ્રા. ૬૨૯ ઉપર ચાલે છે અને તેમાં પણ આવતા થોડા દિવસોમાં ડ્રા. ૬૪૪ અને તે પછી ડ્રા. ૬૭૦નો ભાવ આવવાની ગણતરી છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

જ્યારે **જનરલ ઇન્સ્યોરન્સ**ના શેરમાં ડ્રા. ૨૦૪ના ભાવથી મજબૂત અપડ્રેન્ડની જગ્યા દેખાય છે. આ સરકારી કંપની ભારતના રિ-ઈન્સ્યોરન્સ

પછી કરેકશન અર્પેક્ષિત છે. એકાદ અઠવારિયું શેર પકડી રાખવામાં કોઈ ચિંતા નથી. **એમસીએકસ**નો શેર ડ્રા. ૧૭૧૦ થયા પછી અત્યારે શોર્ટટર્મ કરેકશનના તબક્કામાં છે અને લગભગ એકથી બે અઠવારિયા કરેકશન અને પ્રોફિટ બુલિંગ બતાવ્યા પછી આ શેરમાં ઝડપી ઉછાળાની સંભાવના છે.

ઈન્ડિયન એનર્જી અત્યારે ડ્રા. ૧૨૦ થઈને ડ્રા. ૧૨૯ ઉપર આવી ગયો છે અને આગામી દિવસોમાં ધીમા સુધારાની જગ્યા છે. અત્યારના બોટમ નજીકના ભાવે ૧૦૦-૨૦૦-૩૦૦ શેર લઈને મૂકી દેવાય અને તેમાં મધ્યમગાળે ડ્રા. ૧૫૦થી ડ્રા. ૧૭૦નો ભાવ જોવા મળવાની ગણતરી.

સીડીએસએલ ડ્રા. ૧૨૫૦ થયા પછી અત્યારે ડ્રા. ૧૨૦૦ ઉપર આવી છે અને તેમાં હજી મૂળ જ મોટી તેજની જગ્યા છે. આવતું એક અઠવારિયું ટૂંકી વધુ ઉપર ટ્રેન્ડ બતાવ્યા પછી તોફાની અઠવારિયા સાથે ડ્રા. ૧૨૬૮ અને તે પછી ડ્રા. ૧૨૯૮ થઈ જવાની ગણતરી અને તેથી થોડાક શેર લઈને મૂકી શકાય.

મ્યુચ્યુઅલ ફંડોની પોલિશન અત્યારે એકદમ ભૂલી શકાય થઈ ગઈ છે. આજથી ૧૫ વર્ષ પહેલા એક વર્ષમાં ડ્રા. ૧૪૦૦૦ કરોડનું ભંડોળ એક્સપોઝીટી દ્વારા આવતું હતું તેને બદલે અત્યારે ૬૨ મહિને ડ્રા. ૧૫૦૦૦ કરોડની રકમ એક્સપોઝીટી દ્વારા મ્યુચ્યુઅલ ફંડોમાં કલવાય છે અને ફંડ મેનેજરો પણ અત્યારે ડોંશિયાર થઈ ગયા છે. અલગ અલગ પ્રકારના ધીમ દર્શાવીને ન્યૂ ફંડ ઓફરમાં જ્યારે ઈન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો જોઈએ ત્યારે ખબર પડે છે કે તેમાં કોઈ જ અલગપણ નથી હોતું કેવળ નવા પ્રકારનું નામ લાવેને ડ્રા. ૨૦૦થી ડ્રા. ૧૦૦૦ કરોડનું ભંડોળ ઊભું કરવાનું તેમજો ધીમી થયા છે અને આ ટ્રેન્ડની પોલિટિવ અસર આગામી દિવસોમાં જોઈ શકાશે.

એચડીએફસી એચએમસીનો શેર મે મહિનાની આખરમાં ડ્રા. ૧૮૦૦ની અંદર ચાલતો હતો જે અત્યારે વધીને ડ્રા. ૨૫૮૦ ઉપર આવી છે અને આગામી દિવસોમાં ડ્રા. ૨૭૨૭ અને તે પછી ધીરે ધીરે ડ્રા. ૨૮૨૮ ભાવની દે તેવી ગણતરી છે. આ શેરમાં કરેકશન શરૂ થયું તે પહેલા ડ્રા. ૩૩૫૦નું વૈપ જોવા મળ્યું હતું અને આ ટ્રેન્ડનો પ્રારંભ થયો હતો. એપ્રિલ, ૨૦૨૩માં ડ્રા. ૨૭૦ સુધી ઉતરી ગયેલો આ શેર ડ્રા. ૩૮૦ ઉપર આવી છે અને આગામી દિવસોમાં નાના કરેકશન પછી આ શેર નવી તેજ સાથે ડ્રા. ૪૨૨ અને તે પછી ડ્રા. ૪૨૭ ઉપર પહોંચવાની સંભાવના છે. પરંતુ એકંદરે ઉછાળો ધીમો હશે તે પાસું ખાસ ધ્યાનમાં રાખવું.

સુડીઆઈ એચએમસીનો શેરનો ડ્રા. ૮૫૫ થયા પછી અત્યારે ડ્રા. ૭૬૭ ઉપર છે અને તેમાં નાના કરેકશનની ગણતરી છે. આવતા થોડા દિવસો દરમ્યાન ભાવ ઘટવાની જગ્યા છે. **બીએસએ લિમિટેડ**ના શેરમાં મૂળ જ ઝડપી ઉછાળો જોવાયા પછી હવે કરેકશન શરૂ છે. મે આખરમાં ડ્રા. ૫૫૦વાળો આ શેર અત્યારે ડ્રા. ૬૨૮ ઉપર ચાલે છે અને તે પાસું ખાસ ધ્યાનમાં રાખવું.

સુડીઆઈ એચએમસીનો શેરનો ડ્રા. ૮૫૫ થયા પછી અત્યારે ડ્રા. ૭૬૭ ઉપર છે અને તેમાં નાના કરેકશનની ગણતરી છે. આવતા થોડા દિવસો દરમ્યાન ભાવ ઘટવાની જગ્યા છે. **બીએસએ લિમિટેડ**ના શેરમાં મૂળ જ ઝડપી ઉછાળો જોવાયા પછી હવે કરેકશન શરૂ છે. મે આખરમાં ડ્રા. ૫૫૦વાળો આ શેર અત્યારે ડ્રા. ૬૨૮ ઉપર ચાલે છે અને તે પાસું ખાસ ધ્યાનમાં રાખવું.

કેમ્યુટર એચ મેટેલ એટલે કે કેમ્સનો શેર ડ્રા. ૨૪૧ ઉપર આવી ગયો છે અને આ શેરમાં હજી મોટી તેજની જગ્યા છે. થોડાક શેરો આ ભાવે લઈને મૂકી શકાય. ધીમા સુધારા સાથે કેમ્સમાં ડ્રા. ૨૮૦ અને તે પછી ધીરે ધીરે ડ્રા. ૩૦૦૦ લક્ષના ભાવની સંભાવના મજબૂત છે. કેફિનની જેમ શેર પણ મલ્ટીબેગર બનવાની તક ધરાવે છે.

ફિનાન્સ કંપનીઓમાં અત્યારે સાચો ગ્રાહક મેળવવા માટે હરિફારી અતિશય તીવ્ર છે અને મોટા ગ્રૂપો પ એક પછી એક પોતાની ફિનાન્સ અન કેપિટલ કંપનીઓ લાવતા જાય છે. તાતા કેપિટલ તો ફિનાન્સના ધંધામાં મોટા પાયે સક્રિય છે અને હવે જો અહીં ફિનાન્સ પણ ૨૮મી

ફિનાન્સ કંપનીઓમાં અત્યારે સાચો ગ્રાહક મેળવવા માટે હરિફારી અતિશય તીવ્ર છે અને મોટા ગ્રૂપો પ એક પછી એક પોતાની ફિનાન્સ અન કેપિટલ કંપનીઓ લાવતા જાય છે. તાતા કેપિટલ તો ફિનાન્સના ધંધામાં મોટા પાયે સક્રિય છે અને હવે જો અહીં ફિનાન્સ પણ ૨૮મી

ફિનાન્સ કંપનીઓમાં અત્યારે સાચો ગ્રાહક મેળવવા માટે હરિફારી અતિશય તીવ્ર છે અને મોટા ગ્રૂપો પ એક પછી એક પોતાની ફિનાન્સ અન કેપિટલ કંપનીઓ લાવતા જાય છે. તાતા કેપિટલ તો ફિનાન્સના ધંધામાં મોટા પાયે સક્રિય છે અને હવે જો અહીં ફિનાન્સ પણ ૨૮મી

ફિનાન્સ કંપનીઓમાં અત્યારે સાચો ગ્રાહક મેળવવા માટે હરિફારી અતિશય તીવ્ર છે અને મોટા ગ્રૂપો પ એક પછી એક પોતાની ફિનાન્સ અન કેપિટલ કંપનીઓ લાવતા જાય છે. તાતા કેપિટલ તો ફિનાન્સના ધંધામાં મોટા પાયે સક્રિય છે અને હવે જો અહીં ફિનાન્સ પણ ૨૮મી

ફિનાન્સ કંપનીઓમાં અત્યારે સાચો ગ્રાહક